



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૦૩/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૪૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૫ કેસ કરી, ૭૦ વ્યક્તિઓને ઝડપી, ૫૦૮ લીટર દેશી દારૂ, ૩૭૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૫૬ બીયરટીન, ૦૨ સ્કુટર અને ૦૨ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૩ કેસ કરી ૧૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૯,૪૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૪૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૦૫૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૯ વ્યક્તિઓને અટકાયત કરી હતી.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૫૪૫/૧૯

નારણપુરા : દિપકકુમાર છોટાલાલ પટેલ (રહે.નિધિ એપાર્ટમેન્ટ પલ્લવ ચાર રસ્તા નારણપુરા) એ તા.૨૫/૦૩/૧૯ નારોજ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૩/૨૦૧૯ ના કલાક ૮/૩૦ થી તા.૨૫/૦૩/૨૦૧૯ ના કલાક ૯/૦૦ દરમિયાન પોતાના મકાન ના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, મીન કોઇન્સ નંગ-૪૦ કિંમત રૂપિયા ૬,૦૦૦/-, ચાંદીના વાસણ કિંમત રૂપિયા ૮,૦૦૦/-, એક બેગ કિંમત રૂપિયા ૨૦૦/- તથા રોકડ રૂપિયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૯,૨૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એચ.રાહોડ ચલાવે છે.

સોનાનો દોરો ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૫૪૬/૧૯

સાબરમતી : ભવેન્દ્રભાઈ સતનજી મિશ્રા (ઉ.વ.૫૨)(રહે.નારાયણી રેસીડંસી સુંદરવન ફ્લેટની અંદર અંધ કલ્યાણ કેંદ્રની બાજુમા રાણીપ) એ તા.૨૫/૦૩/૨૦૧૯ બપોરના ૪/૦૦ વાગ્યા ના સુમારે સાબરમતી કાળીગામ એફ.સી.આઇ. ના ગોડાઉન પાસે કંટેનર ડેપોના ગેટની સામે રોડ ઉપર ભવેન્દ્રભાઈ પોતાની એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ભવેન્દ્રભાઈના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૬,૦૦૦/- મતા ની ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ભવેન્દ્રભાઈ મિશ્રા એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.એમ.ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૫૪૭/૧૯

કાગડાપીઠ : યુનીલાલ વિનાજી પ્રજાપતિ (ઉ.વ.૪૩)(રહે,સોનીનો ખાંચો, કાપડીવાડ રાયપુર) એ તા.૨૫/૦૩/૧૯ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૨/૨૦૧૯ ના કલાક ૮/૩૦ થી તા.૧૦/૦૩/૨૦૧૯ સાંજના ૬/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન ગીતામંદિર એસ.ટી.બસ સ્ટેન્ડ હબટાઉનના પાર્કિંગમા પોતાની માણ્ણિ સુઝુકી સ્વીફ્ટ ડિઝાઇર ગાડી નંબર જી.જે.૦૧.આર.ડી.૨૦૨૭ કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી. જેની કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.પટેલ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૫૪૮/૧૯

યાંદખેડા: શિલ્પાબહેન ડો/ઓ ભીખાભાઇ સોલંકી (ઉ.વ.૧૬) (રહે. હનુમાનવાસ મોટેરા ગામ) એ અગમ્ય કારણસર તા.૨૪/૩/૧૯ બપોરના ૪/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસેડ પી લીધું હતું. સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૫/૩/૧૯ કલાક ૧૨/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે યાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એસ.ચૌધરી ચલાવે છે.

સરદારનગર: લક્ષ્મીબહેન વા/ઓ પ્રવીણભાઇ વાઘેલા (ઉ.વ.૨૭) (રહે. વાલ્મીકી આવાસ યોજના નોબલનગર સરદારનગર) એ અગમ્ય કારણસર તા.૨૫/૩/૧૯ નારોજ પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી આર.જી.બારોટ ચલાવે છે.

ઓઢવ: જવાનભાઇ કસ્તુરભાઇ વણઝારા (ઉ.વ.૩૫) (રહે. નાનજીદેશમુખના ચાર માળીયા ઓઢવ) એ અગમ્ય કારણસર તા.૨૫/૩/૧૯ રાતના ૦૦/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે તેમને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન બપોરના ૧/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.